

LL.B. Semester - 1 (CBCS) Examination
Oct/Nov. -2019 (NEW COURSE)
BANKING LAW(CORE/ELECTIVE)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	ભારતમાં બેંકિંગ સંસ્થાઓનો વિકાસ સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૧	૧૯૪૮ના બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ બેંકિંગ કંપનીઓ ક્યાં કાર્યો કરી શકે અને ક્યાં કાર્યો ન કરી શકે તે જણાવો.	
પ્રશ્ન.૨	બેંકર અને ગ્રાહક વચ્ચેનાં સંબંધ સામાન્ય લેણદાર – દેવાદારનાં સંબંધોથી કઈ રીતે જોદો પડે છે?	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૨	રિઝર્વ બેંકના કોઈ પણ ત્રણ મહત્વનાં કાર્યો જણાવો.	
પ્રશ્ન.૩	વચન ચિઠ્ઠી એટલે શું? વચન ચિઠ્ઠી અને વિનિમય પત્ર વચ્ચેનો તફાવત સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૩	નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટનું મહત્વ અને લક્ષણો જણાવો.	
પ્રશ્ન.૪	નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું? તેનાં અનુમાનોની ચર્ચા કરો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૪	વિનિમયપત્રની વ્યાખ્યા આપો અને તેનાં આવશ્યક તત્વો જણાવો.	
પ્રશ્ન. ૫	ટૂંકમાં જવાબ આપો. (કોઈ પણ બે)	(૧૪)
	(1) ચેકનો અનાદર.	
	(2) કોસિગનાં પ્રકારો.	
	(3) દ્રિઅર્થી ઇન્સ્ટ્રુમેન્ટ.	
	(4) આંતરદેશી અને વિદેશી ઇન્સ્ટ્રુમેન્ટ.	

ENGLISH VERSION

Q.1	Explain the development of banking institutions in India.	(14)
	OR	
Q.1	Which types of act can be done and cannot, be done by bankers ? Discuss under the provisions of Banking Regulation Act, 1949?	
Q.2	How the relation of creditor – debtor can be distinguished from the Banker and customer?	(14)
	OR	
Q.2	State any three important functions of the Reserve bank.	
Q.3	Define “promissory Note” State the differences between promissory note and bill of exchange.	(14)
	OR	
Q.3	Give the importance and characteristics of negotiable instrument under the negotiable Instrument Act.	
Q.4	Define Negotiable Instrument. State the presumptions of it.	(14)
	OR	
Q.4	Define the Bill of Exchange and give its essential elements.	
Q.5	Explain: (any two)	(14)
	(1) Dishonour of cheque.	
	(2) Kinds of crossing.	
	(3) Ambiguous Instruments.	
	(4) Inland and foreign Instruments.	
